



HDS-16080002030505

Seat No. _____

M. Com. (CBCS) (Sem. III) (W.E.F.-2016) Examination

November / December – 2017

Advanced Business Statistics - III

(Statistical Inference) (Grp. - 5 - STA) (New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- સૂચના :**
- (1) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
 - (2) જમણી બાજુએ ગુણ દર્શાવ્યા છે.
 - (3) આંકડાશાસ્ત્રીય કોષ્ટકો વિનંતીથી આપવામાં આવશે.

- ૧** (અ) આગણન માટેની મહત્તમ વિસંભાવનાની રીત સમજવો અને મહત્તમ વિસંભાવના આગણકના ગુણધર્મો લખો. **૧૦**
- (બ) બિન્દુ આગણન અને અંતરાલ આગણન સમજવો. **૧૦**

અથવા

- ૧** (અ) સમજવો : **૧૫**
- (૧) આગણક અને પ્રાચલ
 - (૨) પ્રમાણિત દોષ અને તેના ઉપયોગો
 - (૩) વિશ્વસનીય સીમાઓ
- (બ) 450 કદના નિર્દર્શના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 30 અને 20 હોય તો સમાણિના સાચા મધ્યકની 95% અને 99% વિશ્વસનીય સીમાઓ શોધો. **૫**

- ૨** (અ) t -વિતરણના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. **૧૦**
- (બ) χ^2 વિતરણના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. **૧૦**

અથવા

- ૨** (અ) F -વિતરણ વિશે ટૂંકનોંધ લખો. **૧૦**
- (બ) 100 વિદ્યાર્થીઓના નિર્દર્શનું અંતિમ પરીક્ષાનું પરીક્ષામ નીચે આપવામાં આવ્યું છે. **૧૦**

	પ્રથમ વર્ગ	દ્વિતીય વર્ગ	તૃતીય વર્ગ	કુલ
ઇકરાઓ	10	28	12	50
ઇકરીઓ	20	22	8	50
	30	50	20	100

એમ કહી શકાય ખરૂ કે પરીક્ષામાં ડેખાવ વિદ્યાર્થીની જાતિ પર આધારીત છે ?

૩ સમજવો : ૧૫

- (૧) પરિકલ્પના પરીક્ષણાની પદ્ધતિ
- (૨) પ્રકાર I અને પ્રકાર II ભૂલો
- (૩) સાર્થકતાની કક્ષા.

અથવા

૩ (અ) બે વિશાળ સમચ્છિમાં અનુક્રમે 30% અને 25% લોકો સુંદર વાળવાળા હતા. 1200 અને 900 પરિમાળવાળા બે નિદર્શ અનુક્રમે બે સમચ્છિમાંથી લેતા તેમાં આ તફાવત છૂપો રહેશે ? ૭

(બ) બે પ્રમાણ્ય સમચ્છિમાંથી લીધેલા નિદર્શો નીચે પ્રમાણો છે. સમચ્છિઓના વિચરણો સમાન છે તે પરિકલ્પનાનું પરીક્ષણ કરો. ૮

નિદર્શ-I : 8 10 14 10 13

નિદર્શ-II : 12 15 11 16 14 14 16

૪ (અ) પ્રાચ્યલીય અને અપ્રાચ્યલીય પરીક્ષણો વચ્ચેનો તફાવત સમજવો. ૫

- (બ) એક વસ્તુની જાહેરાત માટે ત્રણ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો અને અનુક્રમે 6, 7 અને 5 કદના નિદર્શો લેવામાં આવ્યા. વેચાણમાં થયેલો વધારો (હજાર રૂ.માં) નીચે પ્રમાણો નોંધવામાં આવ્યો :

નિદર્શ-I : 80 83 79 85 90 68

નિદર્શ-II : 82 84 60 72 86 67 91

નિદર્શ-III : 93 65 77 78 88

કુસ્કલ વાલિસ પરીક્ષણાનો ઉપયોગ કરીને ગજોય જાહેરાતની પદ્ધતિઓથી વેચાણમાં થયેલ સરેરાશ વધારો છે તે પરિકલ્પનાનું પરીક્ષણ કરો.

અથવા

૪ સમજવો : ૧૫

- (૧) વિલકોક્ષન ચિહ્નન કમાંક પરીક્ષણ
- (૨) સાનુક્રમ પરીક્ષણ
- (૩) મેન વ્હીટની પરીક્ષણ.

ENGLISH VERSION

Instructions : (1) All questions are compulsory.
(2) Marks are indicated on right side.
(3) Statistical tables will be given on request.

- 1** (a) Explain the maximum likelihood method of estimation and write the properties of maximum likelihood estimator. **10**

- (b) Explain point estimation and interval estimation. **10**

OR

- 1** (a) Explain : **15**
(1) Statistic and parameter
(2) Standard error and its uses
(3) Confidence limits

- (b) A sample of 450 size has mean 30 and standard deviation 20. Find the 95% and 99% confidence limits of true population mean. **5**

- 2** (a) State the properties and uses of t -distribution. **10**
(b) State the properties and uses of χ^2 distribution. **10**

OR

- 2** (a) Write short note on F-distribution. **10**
(b) The result in the final examination of a sample of 100 students in given below : **10**

	First Class	Second Class	Third Class	Total
Boys	10	28	12	50
Girls	20	22	8	50
	30	50	20	100

Can it be said that performance in the examination depends upon sex ?

- 3** Explain : **15**
(1) The procedure of testing of hypothesis
(2) Type - I and Type - II errors.
(3) Level of significance.

OR

3 (a) In two large populations there are 30% and 25% fair 7
haired people respectively. Is this difference likely to
be hidden in samples of 1200 and 900 respectively from
two populations.

(b) The following samples are drawn from two normal 8
population test the hypothesis that the population
variances are equal :

Sample - I : 8 10 14 10 13

Sample - II : 12 15 11 16 14 14 16

4 (a) Explain the difference between parametric and non 5
parametric tests.

(b) Three different methods of advertising a commodity 10
were used and the respective samples of sizes 6, 7 and
5 were taken. The increased sales (in Rs. '000) were
recorded as follows :

Sample-I : 80 83 79 85 90 68

Sample-II : 82 84 60 72 86 67 91

Sample-III : 93 65 77 78 88

Use Kruskal Wallis test. Test the hypothesis that
mean increases in sales due to the three methods
advertising is same.

OR

4 Explain : 15

- (1) Wilcoxon signed rank test
- (2) Run test
- (3) Mann Whitney test.